

CIN: L27320GJ2016PLC094314

Date: September 09, 2023

To, BSE Limited Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400001.

Respected Sir/Ma'am,

Sub: Newspaper Advertisement of 07th Annual General Meeting of the Members of Poojawestern Metaliks Limited.

Ref: Poojawestern Metaliks Limited (Security Code/Security Id: 540727/POOJA)

With reference to caption subject, we would like to inform you that the Notice of 07th Annual General Meeting (AGM) was published on Saturday, September 09, 2023 in "Financial Express" in English Language Newspaper and in "Financial Express" Gujarati Language Newspaper.

Further, Pursuant to Regulation 30 of SEBI (Listing Obligation and Disclosure requirement) Regulations, 2015 and Schedule III, Kindly note that the Company has completed the process of issuing notice of AGM to the members along with Annual Report For the Financial year 2022-23 and instruction for e-voting & attaining AGM through VC/OAVM on Wednesday, September 06, 2023.

Please find enclosed herewith the copy of Newspaper advertisement of the Annual General Meeting and instruction for e-voting VC/OAVM.

Please take the same on your record.

For, Poojawestern Metaliks Limited

Sunil Devram Panchmatiya Chairman & Managing Director

DIN: 02080742

Place: Jamnagar

Encl: A/a

POOJAWESTERN METALIKS LTD

FINANCIAL EXPRESS



एसजेवीएन लिमिटेड SJVN Limited (मारत सरकार एवं हिमाचल प्रदेश सरकार का संयुक्त उपक्रम) (A Joint Venture of Govt. of India & Govt. of H.P.) A Mini Ratna & Schedule 'A' PSU CIN: L40101HP1988GOI008409

NATHPA JHAKRI HYDRO POWER STATION

PRESS NOTICE / E-Tendering No. Package(P)-311(O&M) Open press global tender enquiries under two-part system

through e-tendering are hereby invited only from the manufacturers or their authorized representative on behalf of SJVN Limited for "Supply of Hard Coating Powder for HVOF Thermal Spray Process of the NJHPS, SJVN Ltd. Jhakri". For details, please visit websites www.sjvn.nic.in, https://etender.sjvn.co.in & www.eprocure.gov.in.

Last date for downloading of bid documents is 08.10.2023 (12:00 Hrs.).

Last date for bid submission is 09.10.2023 (13:00 Hrs.). Amendment (s), if any, shall be issued on above websites only.

> For and on behalf of SJVN Ltd. Dy General Manager, P&C deptt. NJHPS, SJVN Ltd., Jhakri. Distt. Shimla, HP-172201

IMP POWERS LIMITED

Corporate Identification Number: L31300DN1961PLC000232 Registered Office: Survey No. 263/3/2/2, Sayli Village, Umar Kuin Road, Silvassa (U. T.) Dadra & Nagar Haveli, Silvassa 396230 Website: www.imp-powers.com Email: cs@imp-powers.com

NOTICE OF THE SIXTY-FIRST ANNUAL GENERAL MEETING AND EVOTING INFORMATION

NOTICE is hereby given that the Sixty-First Annual General Meeting (AGM) of the members of IMP Powers Limited ("the Company") will be held on Saturday, September 30, 2023 at 11.00 a.m. (I.S.T.) through Video Conferencing('VC') / Other Audio-Visual Means ('OAVM') to transact the business as set out in the Notice of AGM dated September 04, 2023, without physical presence of the members at a common venue.

In compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder, read with General Circular No. 10/2022 dated December 28, 2022 and General Circular Nos. 02/2022, 21/2021, 19/2021, 02/2021,14/2020, 17/2020 and 20/2020 dated May 05, 2022, December 14, 2021, December 08, 2021, January 13, 2021, April 08, 2020, April 13, 2020 and May 05, 2020 respectively, issued by the Ministry of Corporate Affairs read with SEBI circulars dated January 05, 2023, May 13, 2022, January 15, 2021 and May 12, 2020, the Company has sent the Annual Report 2022-23 alongwith Notice of the AGM on September 04, 2023 through electronic mode to all the members whose email IDs are registered with the Depository Participant(s)/ Company/ Link Intime India Private Limited, the Company's Registrar and Share Transfer Agents (RTA).

The Annual Report of the Company for the FY 2022-23 along with Notice of AGM and evoting instructions is also available on the Company's website (www.imp-powers.com), website of the Stock Exchange(s) i.e. BSE Limited (www.bseinda.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of National Securities Depository Limited ("NSDL") (www.evoting.nsdl.com)

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the Listing Regulations, the Company is pleased to provide the Members with the facility to cast their votes electronically ("remote e-voting") as well e-voting at AGM through e-voting services of NSDL in respect of all the businesses to be transacted at the AGM.

The voting rights of the Members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on Saturday, September 23, 2023 ("cut-off date"). An person, whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories/RTA as on the cut-off date only shall be entitled to cast vote either through remote e-voting or e-voting at the AGM. Any person who acquires the shares of the Company and becomes a Member of the Company after the dispatch of the Notice of AGM and holding shares as on cut-off date, may follow the instructions given in the notice of AGM to cast their vote and attend the AGM.

The remote e-voting period shall commence from Wednesday, September 27, 2023 at 9.00 a.m. and end on Friday, September 29, 2023 at 5.00 p.m. (I.S.T.). During this period, Members can select EVEN 126296 to cast their votes electronically. The remote e-voting module shall be disabled by NSDL after 5.00 p.m. on Friday, September 29, 2023.

The facility for voting through electronic means shall also be provided at the AGM. Those Members, who are present at the AGM through VC/OAVM facility and have not already cast their votes on the resolutions via remote e-voting shall be eligible to vote through evoting system during the AGM. The Members, who have cast their vote by remote e-voting prior to AGM, may also attend the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again at the AGM. The procedure and manner to attend AGM and cast vote using e-voting system of NSDL has been provided in the Notice of AGM.

The Members of the Company who have not registered their e-mail address can register the same as per the following procedure:

- 1. The members holding shares in physical form may get their email addresses registered with Company's RTA by providing Form ISR-1 duly filled and signed by the Member together with the supporting documents as stated therein.
- The members holding shares in demat form may get their email address registered with their respective Depository Participant(s).

However, for receiving soft copy of Annual Report of FY 2022-23 and Notice of 61st AGM, such members may send an email to cs@imp-powers.com alongwith their details such as

Name of shareholder, DPID / Client ID, PAN and mobile number. In case of any queries relating to e-voting, with respect to remote e-voting or e-voting at the AGM and members may contact NSDL on evoting@nsdl.co.in / 1800 1020 990 and 1800 22 44 30 or NSDL at evoting@nsdl.co.in or refer to the Frequently Asked Questions (FAQs) section / e-voting user manual for shareholders available at the Downloads section

For IMP Powers Limited

Place:Mumbai Date: September 08, 2023

Mukesh Verma Resolution Professional

MISHTANN FOODS LIMITED

Regd. Office: B-905, Empire Business Hub, Opp. Shakti Farm, Science City Road, Sola, Daskroi, Ahmedabad Gujarat 380060 **Tel. No.** +91 9824623116, **Fax No.** +91 7940033116 Website: www.mishtann.com, Email Id: cs@mishtann.com

Notice of Annual General Meeting and E-Voting Information

NOTICE IS HEREBY GIVEN that the forty third (43rd) Annual General Meeting of the Company will be held on Friday, 29th September, 2023, at 11.00 a.m. through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM"), to transact the business as set out in the Notice of AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("ACT") and rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements)

The Notice of AGM along with the Annual Report for Financial Year 2022-23, inter-alia, containing Board's Report, Auditor's Report and Audited Financial Statement has been sent only by electronic mode to those members whose Email ID are already registered with the Company/Depository Participants as on cut-off date of dispatch of Notice. The Company has completed the dispatch of Notice and Annual Report to all the members on September 06, 2023 and the same are also made available on the website of the Company at www.mishtann.com, NSDL at www.evoting.nsdl.com, BSE Limited at www.bseindia.com and Metropolitan Stock Exchange of India Limited at

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 read with rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meeting (SS-2) issued by the ICSI, Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using

Members holding either in physical form or dematerialized form as on the cutoff date of 22nd September, 2023 shall be entitled to e-voting on the

Cut-off date for determining for eligibility of Members for Friday, September 22, voting through remote e-voting and voting at AGM and 2023

payment of Final Dividend for FY 2022-23 Day, Date and Time of commencement of remote e-voting Tuesday, September 26, 2023(09.00 A.M.)

Thursday, September 28, 2023 (05.00 P.M.)

The e-voting module will be disabled by the NSDL thereafter.

the Company after dispatch of the Notice and holding shares as on the cut-off date i.e September 22, 2023 may obtain the user id and password by sending the request at evoting@nsdl.co.in. However, if the person is already registered with NSDL for remote e-voting then existing user id and password can be used for casting vote.

For details relating the remote e-voting please refer to the Notice of the AGM. In case of any queries relating to voting by electronic means, please refer to the frequently asked questions (FAQs) and e-voting user manual for the members available at the downloads section of www.evoting.nsdl.com.

Further, pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Saturday, September 23, 2023 to Friday, September 29, 2023 (both days inclusive) for the purpose of 43rd Annual General Meeting.

> For, Mishtann Foods Limited Shivangi Shah

DEEP POLYMERS LIMITED

CIN: L25209GJ2005PLC046757 Registered office: Block No. 727 & 553, Rakanpur (Santej), Taluka: Kalol, Gandhinagar, Gujarat- 382721, India. Email Id: cs.deeppolymers@gmail.com | Tel no. 02764-286032

NOTICE OF 18TH ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE

Annual General Meeting: NOTICE is hereby given that the 18th Annual General Meeting ('AGM') of the Members of Deep Polymers Limited (the 'Company') will be held on Saturday, 30th September 2023 at 03:00 p.m. (IST) through Video Conference ("VC") / Other Audio Visual Means ('OAVM') only, to transact the business as set out in the Notice of AGM dated 07th September, 2023.

Dispatch of Notice and Annual Report: In accordance with the General Circular No. 10/2022 dated 28th December, 2022 & other earlier Circulars in this regard issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January, 2023 and & other earlier Circulars in this regard issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars'), the Notice of the 18th AGM along with the Annual Report 2022-23 has been sent through electronic mode on 06th September, 2023, to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Share Transfer Agent ('RTA') or Depository Participant(s) as on 02nd September, 2023. The Company shall send physical copy of the Annual Report 2022-23 to those Members who request for the same mentioning their DP ID and Client ID.

The Annual Report 2022-23 of the Company, inter alia, containing the Notice and the Explanatory Statement of 18th AGM is available on the website of the Company at www.deeppoly.com and on the websites of the Stock Exchange www.bseindia.com. Acopy of the same is also available on the website of Central Depository Services Limited ('CDSL')

Remote e-voting: In compliance with Section 108 of the Companies Act, 2013 ('the Act') read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, the Secretarial Standard on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing to its Members the facility of remote e-voting before AGM and e-voting during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed CDSL for facilitating voting through electronic means.

The detailed instructions for remote e-Voting are given in Notes to the Notice of the AGM. The Members are requested to note the following:

a. The remote e-Voting facility would be available during the following period: Commencement of remote e-voting | Wednesday, 27th September, 2023 at 09:00 a.m. Conclusion of remote e-Voting Friday, 29th September, 2023 at 05:00 p.m. The remote e-Voting module shall be disabled automatically by CDSL for voting thereafter

the vote is cast by a Member, Member shall not be allowed to change it subsequently.

and Members will not be allowed to vote electronically beyond the said date and time. Once

The voting rights of the Members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on Saturday, 23rd September, 2023 ('cut-off date'). The facility of remote e-Voting system shall also be made available during the Meeting and the Members attending the Meeting, who have not already cast their vote by remote e-Voting shall be able to exercise their right during the Meeting. A person whose name is recorded in the Register of Members / Register of Beneficial Owners as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-Voting before / during the AGM. Members who have cast their vote by remote e-Voting prior to the Meeting may also attend the Meeting electronically, but shall not be entitled to vote again.

Members can also login by using the existing login credentials of the demat account held through Depository Participant(s) registered with National Securities Depository Limited (NSDL) or CDSL for e-voting facility.

Members facing any technical issue in login can contact:

Helpdesk details Securities with CDSL helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 and 022-23058542-43 Securities with NSDL evoting@nsdl.co.in or

call at toll free no.: 1800 1020 990 or 1800 224 430 A person who is not a member as on the cut-off date should treat the Notice of the AGM.

Ms. Dhyanam Vyas proprietor of M/s. Dhyanam Vyas and Associates., Practicing Company Secretary, has been appointed as the Scrutiniser to scrutinise the remote e-

Voting process before / during the AGM in a fair and transparent manner. Book Closure: Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI LODR Rules, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Sunday, 24th September, 2023 to Saturday, 30th September, 2023 (both days inclusive) for the purpose of 18th AGM.

Information / Clarifications with respect to Annual Report: As the AGM is being conducted through VC / OAVM, members desiring any information relating to the Annual Financial Statements of the Company or those who would like to express their views or ask questions during the AGM may register themselves as a speaker by sending an email to the Company at cs@deeppolymers@gmail.com at least 7 days before the AGM, mentioning their name, complete 16 digit demat account no. (DP ID and Client ID), e-mail address and mobile number. Only those requests as received from the members on the aforementioned e-mail address shall be considered and responded during the AGM.

For, Deep Polymers Limited

Rameshbhai Bhimjibhai Patel Date: 09/09/2023 Managing Director DIN: 01718102 Place: Gandhinagar

ARYAVAN ENTERPRISE LIMITED

CIN: L52100GJ1993PLC018943 Registered office: 308, Shital Varsha Arcade, Opp. Girish Cold Drinks, C. G. Road, Navrangpura, Ahmedabad, Gujarat- 380009. Email id: investor.deepti@gmail.com | Tel No. 079-26440427

NOTICE OF 31ST ANNUAL GENERAL MEETING, E-VOTING AND BOOK CLOSURE

NOTICE is hereby given that the 31" Annual General Meeting ('AGM') of the Members of Aryavan Enterprise Limited (the 'Company') will be held on Saturday, 30" September 2023 at 10:30 a.m. (IST) through Video Conference ('VC') / Other Audio-Visual Means ('OAVM') only, to transact the business as set out in the Notice of AGM dated 06" September, 2023.

In accordance with the General Circular No. 10/2022 dated 28" December, 2022 & other earlier Circulars in this regard issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circular No. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 5th January, 2023 and & other earlier Circulars in this regard issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars'), the Notice of the 31" AGM along with the Annual Report 2022-23 has been sent through electronic mode on 06" September, 2023, to those Members whose e-mail addresses are registered with the Company / Registrar & Share Transfer Agent ('RTA') or Depository Participant(s) as on 02" September, 2023. The Company shall send physical copy of the Annual Report 2022-23 to those Members who request for the same mentioning their DP ID and Client ID.

The Annual Report 2022-23 of the Company, inter alia, containing the Notice and the Explanatory Statement of 31" AGM is available on the website of the Company at www.deeptialloysteel.com and on the websites of the Stock Exchange www.bseindia.com. A copy of the same is also available on the website of Central Depository Services Limited ('CDSL') at

www.evotingindia.com.

In compliance with Section 108 of the Companies Act, 2013 ('the Act') read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, the Secretarial Standard on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing to its Members the facility of remote e-voting before AGM and e-voting during the AGM in respect of the business to be transacted at the AGM and for this purpose, the Company has appointed CDSL for facilitating voting through electronic

The detailed instructions for remote e-Voting are given in Notes to the Notice of the AGM. The

Members are requested to note the following: The remote e-Voting facility would be available during the following period: Commencement of remote e-Voting Wednesday, 27th September, 2023 at 09:00 a.m. Conclusion of remote e-Voting Friday, 29th September, 2023

at 05:00 p.m. The remote e-Voting module shall be disabled automatically by CDSL for voting thereafter. and Members will not be allowed to vote electronically beyond the said date and time. Once the vote is cast by a Member, Member shall not be allowed to change it subsequently

The voting rights of the Members shall be in proportion to their share in the paid-up equity share capital of the Company as on Saturday, 23" September, 2023 ('cut-off date'). The facility of remote e-Voting system shall also be made available during the Meeting and the Members attending the Meeting, who have not already cast their vote by remote e-Voting shall be able to exercise their right during the Meeting. A person whose name is recorded in the Register of Members / Register of Beneficial Owners as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-Voting before / during the AGM. Members who have cast their vote by remote e-Voting prior to the Meeting may also attend the Meeting electronically, but shall not be entitled to vote again.

Members can also login by using the existing login credentials of the demat account held through Depository Participant(s) registered with National Securities Depository Limited (NSDL) or CDSL for e-voting facility.

Members facing any technical issue in login can contact: Login Type Helpdesk details helpdesk.evoting@cdslindia.com or Securities with CDSL contact at 022-23058738 and 022-23058542-43 evoting@nsdl.co.in or Securities with NSDL call at toll free no.: 1800 1020 990 or 1800 224 430

information purposes only. Ms. Dhyanam Vyas proprietor of M/s. Dhyanam Vyas and Associates., Practicing Company Secretary, has been appointed as the Scrutiniser to scrutinise the remote e-Voting process before / during the AGM in a fair and transparent manner.

A person who is not a member as on the cut-off date should treat the Notice of the AGM for

Book Closure: Pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI LODR Rules, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Sunday, 24th September, 2023 to Saturday, 30th September, 2023 (both days inclusive) for the purpose of 31st AGM.

Information / Clarifications with respect to Annual Report:

As the AGM is being conducted through VC / OAVM, members desiring any information relating to the Annual Financial Statements of the Company or those who would like to express their views or ask questions during the AGM may register themselves as a speaker by sending an email to the Company at investor.deepti@gmail.com at least 7 days before the AGM, mentioning their name, complete 16 digit demat account no. (DP ID and Client ID), e-mail address and mobile number. Only those requests as received from the members on the aforementioned e-mail address shall be considered and responded during the AGM. For, Aryavan Entrprise Limited

Prafullchandra Patel Date: 09.09.2023 Managing Director DIN: 08376125 Place: Ahmedabad



related parties:

POWER AND INSTRUMENTATION (GUJARAT) LIMITED Registered Office: B-1104 Sankalp Iconic, Opp Vikram Nagar, Iscon Temple Cross- Road, S. G. Highway, NA Ahmedabad Ahmedabad GJ 380054 IN Phone No.: +91-99099916450 Email: harshit@grouppower.org CIN: L32201GJ1983PLC006456, Website: https://power-instrumentation.grouppower.org

NOTICE OF ANNUAL GENERAL MEETING

Members are hereby informed that dispatch of the 39" Annual General Meeting Notice dated September 04, 2023 (along with the Explanatory Statement) to the members of the Company in respect of the Resolutions as set out in the Notice of Annual General Meeting has been completed on Friday 08, September 2023.

Item No. 1: To Receive, Consider and Adopt the Audited Balance Sheet as at March 31 2023, Statement of Profit & Loss together with Cash Flow Statement and Notes forming part thereto ("Financial Statements") for the year ended on March 31, 2023 and Report of the Board of Directors and Auditors thereon;

Item No. 2: To appoint a director in place of Mr. PADMARAJ PADMNABHAN PILLAI (DIN: 00647590) who retires by rotation and being eligible, offers himself for re-

Item No. 3: To declare Final Dividend of 0.20 (Twenty Paisa Only) (i.e.2%) per equity share for the Financial Year ended March 31, 2023 as recommended by the Board of

Directors. Item No. 4: To approve related party transactions to be entered by the Company with

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended by Companies (Management and Administration) Rules, 2015, and Regulation 44 of the Listing Obligations and Disclosure Requirements Regulations, 2015, Members are provided with the facility to cast their votes on all resolutions set forth in the Notice of the AGM using electronic voting system from a place other than the venue of the AGM, provided by CDSL and the business may be transacted through such voting.

The Final Dividend, subject to approval of Members at the Annual General Meeting on 29" September, 2023, will be paid to the Members whose names appear in the Register of Members, as on the date of Book Closure/Record Date of the Company and for that the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, 23" September, 2023 to Friday, 29th September, 2023 and Saturday, 23 September, 2023 will be consider the Record Date for the final dividend.

ends on Thursday, September 28, 2023 at 5.00 p.m. IST. During this period, Members may cast their vote electronically. The e-voting module shall be disabled by CDSL thereafter. A vote once cast on the resolution, would not be allowed to be changed subsequently. The procedure for e-voting at the AGM is same as the procedure for remote e-voting.

The e-voting period commences on Tuesday, September 26, 2023 at 9.00 a.m. IST and

Only those Shareholders, who will be present at the AGM through VC / OAVM facility and who would not have cast their vote on the resolutions set forth in the Notice of AGM by remote e-voting prior to the AGM and are otherwise not barred from doing so shall be eligible to vote through e-voting system at the AGM on such resolutions. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in

the paid-up equity share capital of the Company as on Friday, September 22, 2023 ('cut-off date'). Any person, who is a Member of the Company as on the cut-off date is eligible to cast vote on all the resolutions set forth in the Notice of AGM using remote evoting or voting at the AGM.

Shareholders are being provided with a facility to attend the AGM through VC / OAVM through the CDSL e-voting system. The Instructions for attending the AGM through VC OAVM are provided in the Notice of the AGM.

For details relating to remote e-voting, please refer to the Notice of the AGM. In case of any queries relating to voting by electronic means, please refer to the FAQ and e-voting manual available at www.evotingindia.com or contact at 022-230585542/43, in case of any grievance relating to e-voting please contact Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk evoting@cdslindia.com or call 022-23058542/43.

For, POWER AND INSTRUMENTATION (GUJARAT) LIMITED

PADMARAJ PILLAI **Managing Director** DIN: 00647590

Date: 08/09/2023

BRIGHT SOLAR LIMITED (CIN: L51109GJ2010PLC060377)

Registered Office: C-602, Titanium Square, Near Thaltej Circle, Thaltej, Ahmedabad - 380059, Gujarat Phone No.: +91 7229035500; Email: compliance@brightsolar.co.in; Website: www.brightsolarltd.com NOTICE OF THE 13" ANNUAL GENERAL MEETING OF THE COMPANY

AND E-VOTING: NOTICE is hereby given, the Thirteenth (13") Annual General Meeting (AGM) of the Members of Bright Solar Limited be held on Saturday, September 30, 2023 at 10:30 A.M. through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of

In accordance with the General Circular No. 10/2022 dated December 28, 2022 issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars") the Notice of AGM along with Annual Report 2022-23 has been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories. Member may note that Notice and Annual Report 2022-23 will be uploaded on the website of the Company at www.brightsolarltd.com, website of NSE Limited at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in Demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 13" AGM and Annual Report 2022-23 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (selfattested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to compliance@brightsolar.co.in.

In case shares are held in DEMAT mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to compliance@brightsolar.co.in

Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.in for obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 13" AGM and Annual Report 2022-23 and the procedure for evoting along with the user-id and the password to enable e-voting for 13" AGM.

In case of any queries, shareholder may write to the Company at compliance@brightsolar.co.in. Shareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their DEMAT accounts if shares are held in dematerialized mode by submitting the requisite

There being no physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company is not closed. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Saturday, September 23, 2023 ("Cut-off date") shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the usinesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on Wednesday, 27th September, 2023 (9.00 A.M. IST) and ends on Friday, 29th September, 2023 (5.00 P.M. IST). During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolutions is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 13th AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 13th AGM may also attend the 13" AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 13" Annual General Meeting.

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Saturday. September 23, 2023, are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote. In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Mr. Ritendra Rathod, Company Secretary of the Company at the Corporate office of the Company or may write an e-mail to compliance@brightsolar.co.in. or may call on +91-7229035500 for any further clarification.

MEMBERS CAN ATTEND AND PARTICIPATE IN THE ANNUAL GENERAL MEETING AT THE THROUGH VC/OAVM FACILITY. THE INSTRUCTIONS FOR JOINING THE ANNUAL GENERAL MEETING THROUGH VC/OAVM ARE PROVIDED IN THE NOTICE OF THE ANNUAL GENERAL MEETING. IN CASE THE SHAREHOLDERS/MEMBERS HAVE ANY QUERIES OR ISSUES REGARDING PARTICIPATION IN THE AGM, YOU CAN WRITE AN EMAIL TO EVOTING@NSDL.CO.IN OR CALL US: - TEL: 1800-222-990. MEMBERS ATTENDING THE MEETING THROUGH VC/OAVM SHALL BE COUNTED FOR THE PURPOSES OF RECKONING THE QUORUM UNDER SECTION 103 OF THE COMPANIES ACT, 2013. For, Bright Solar Limited

Piyushkumar Thumar

Place: Ahmedabad

Chairman and Managing Director DIN: 02785269

INDO TECH

INDO-TECH TRANSFORMERS LIMITED

CIN: L29113TN1992PLC022011 Regd. Office: Survey No. 153-210, Illuppapattu Village, Near Rajakulam, Kancheepuram (Dist.) Tamilnadu - 631561. Tel: +91 44 27281854 Email: investor@indo-tech.com; Website: www.indo-tech.com

NOTICE OF 31" ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 31" Annual General Meeting ("AGM") of the Company will be held on Friday, the 29" day of September 2023 at 10:30 A.M. Indian Standard Time ("IST") through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), to transact the businesses as set out in the Notice of AGM.

The Ministry of Corporate Affairs ("MCA") has vide its General Circular Nos. 10/2022, 20/2020, 17/2020 and 14/2020 (collectively referred as "MCA Circulars"), permitted holding of AGM through VC / OAVM, without physical presence of members at a common venue. In compliance with the Circulars, relevant provisions of the Companies Act, 2013 and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the Company will be held through VC /OAVM. In case you have any queries or issues regarding login, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.instameet.linkintime.co.in or write an e-mail to instameet@linkintime.co.in or call 022-49186175.

The Annual Report for the financial year ended 2022-23 along with the notice of AGM has been dispatched on September 07, 2022, through electronic mode to all Members whose email addresses are registered with the Company/Depository Participant(s). These documents are also available on the Company's website www.indo-tech.com, websites of the Stock Exchanges e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Link Intime India Private Limited at instavote.linkintime.co.in.

Pursuant to Section 91 of the Companies Act, 2013 and the Rules made thereunder and Regulation 42 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Saturday, September 23, 2023, to Friday, September 29, 2023 (both days inclusive) for the purpose of AGM. Members holding shares either in physical or dematerialized form as on the cut-off-date Friday, September 22, 2023, may cast their votes electronically on the businesses as set out in the AGM Notice through e-voting platform of Link Intime India Private Limited.

Members are hereby informed that the business as set out in the AGM notice may be transacted through remote e-voting or e-voting system at the AGM. The remote e-voting shall commence on Tuesday, September 26, 2023 at 9:00 A.M. and end on Thursday, September 28, 2023 at 5:00 P.M. The remote e-voting module shall be disabled by Link Intime India Private Limited beyond 5:00 p.m. on September 28, 2023. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM. Members who have voted through Remote e-Voting may also attend the AGM through VC/OAVM but shall not be eligible to cast their votes again. Once the vote on a resolution is cast by a member, he/she shall not be allowed to change it subsequently.

Any person, who becomes member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off-date i.e., September 22, 2023, may obtain User ID & password for e-voting by sending an e-mail intimating DP ID & Client ID/Folio No. at enotices@linkintime.co.in. However, if he/she is already registered with e-voting of Link Intime India Private Limited / NSDL / CDSL, then he/she can use his/her existing Used ID & password for casting votes. The detailed procedure (instructions for e-voting, registration of email ID and participation in AGM through VC/OAVM are contained in the Notice of AGM.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions("FAQs") and e-voting manual available at https://instavote.linkintime.co.in/Home or write an e-mail to enotices@linkintime.co.in or call on 022-49186000.

> By order of the Board of Directors For Indo-Tech Transformers Limited

> > Company Secretary

Manikandan M

POOJAWESTERN METALIKS LIMITED

Date: September 07, 2023

Place: Kancheepuram

Corporate Identity Number (CIN): L27320GJ2016PLC094314 Regd Office: Plot No.1, Phase II, GIDC, Dared, Jamnagar, Gujarat - 361004, India Tel No: 288-2730088, Website:www.poojametal.com,Email-poojametals@gmail.com NOTICE OF THE 7th ANNUAL GENERAL MEETING

OF THE COMPANY AND E-VOTING

NOTICE is hereby given that Pursuant to the General Circular No. 10/2022 dated December 28, 2022, issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars") companies are allowed to hold AGM through VC, without the physical presence of members at a common venue. Hence, in compliance with the Circulars, the AGM of the Company is being held through VC on Saturday September 30, 2023 at 12:00 P.M. (IST). The deemed venue of the proceedings of the 7th AGM shall be the Registered Office of the Company i.e. Plot No. 1, Phase II, GIDC, Dared Jamnagar -361004, Gujarat to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 7th AGM.

In accordance with the General Circular No. 10/2022 dated December 28. 2022, issued by the Ministry of Corporate Affairs (MCA) and Circular SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 issued by SEBI (hereinafter collectively referred to as "the Circulars") the Notice of AGM along with Annual Report 2022-23 has been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company Depositories. Member may note that Notice and Annual Report 2022-23 will be uploaded on the website of the Company at www.poojametals.com website of BSE Limited at www.bseindia.com and website of Nationa Securities Depository Limited (NSDL)i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 7th AGM and Annua Report 2022-23 could not be serviced, may temporarily get their e-mai addresses registered by following the procedure given below:

1. In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back) PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to info@poojametal.com

In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to info@poojametal.com.

3. Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.infor obtaining User ID and Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be.

Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of 7th AGM and Annual Report 2022-23 and the procedure for e-voting along with the user-id and the password to enable evoting for 7th AGM. In case of any queries, shareholder may write to the Company at info@poojametal.com. Shareholders are requested to register update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on Saturday September 23, 2023 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and e-voting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating voting through electronic means.

The remote e-voting will commence on 9:00 A.M. on Wednesday. September 27, 2023 and will end on 5:00 P.M. on Friday, September 29, 2023. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of evoting shall be made available at the 7th AGM; and c) the members who have cast their vote by remote e-voting prior to the 7th AGM may also attend the 7th AGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 7th Annual General

Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Saturday, September 23, 2023, are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Mr. Tejus Rameshchandra Pithadiya, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to www.poojametals.com for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility. The instructions for joining the Annual General Meeting through VC/OAVM are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the guorum under Section 103 of the Companies Act, 2013.

For, Pooja Western Metaliks Limited

Sunil Devram Panchmatiya Chairman and Managing Director DIN: 02080742

financialexp.epapr.in

Date: 06-09-2023

on https://www.evoting.nsdl.com.

Regulations, 2015.

www.msei.in.

electronic voting system, provided by the NSDL.

businesses as set out in the Notice of 43rd Annual General Meeting.

Day, Date and Time of end of remote e-voting

Any person who acquires shares of the Company and becomes a member of

Company Secretary Place: Ahmedabad

Place: Jamnagar

Date: September 08, 2023

CIN: L17290GJ2005PLC046345 Registered Add: 10 Mill Officers Colony, Behind Old Rbi, Ashram Road Ahmedabad Gj 380009

Notice is hereby given that the 13th Annual General Meeting (13th AGM) of the Members of **Riddh**Corporate Services Limited will be held on Thursday, 28th September, 2023 at 11:00 a.m. to ransact the business, as set out in the Notice of the 13th AGM. The Company has sent the Annua

transact the business, as set out in the Notice of the 13" AGM. The Company has sent the Annual Report along with Notice convening AGM on Wednesday, 6" September, 2023, through electronic mode to all the Members whose e-mail IDs are registered with the Company's Registrar & Share Transfer Agent, M/S. PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD/Depository Participant(s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5" May, 2020 and 13" April, 2020 and the Securities and Exchange Board of India circular dated 12" May, 2020. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.riddhicorporate.co.in, BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evoltinglindia.com.

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Ac

2013, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday 22rd September, 2023 to Thursday 28rd September, 2023 (both the days inclusive) for the ourpose of 13rd AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Managemen

Pursuant to the povisions or Section 108 of the Act and Rule 20 of the Companies (wanagement and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through e-voting services provided by the CDSL on all resolutions as set forth in the 13th AGM Notice. The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Thursday, September, 21, 2023 (cut-off date).

The remote e-voting period commences on Monday, 25° September, 2023 at 9.00 a.m. and will end on Wednesday, 27° September, 2023 at 5.00 p.m. During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM and had not cast their votes on the Resolutions through

emote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote throug

Frount gysternount (18-48). The manner of remote e-voting and voting at the AGM by members holding shares lematerialized mode, physical mode and for members who have not registered their emanders is provided in the Notice of the AGM.

Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date; may obtain the login ID and password by sending a request to helpdesk evoting@cdslindia.com. However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.

Members whose email addresses are already registered with the Company/Depositories, may follow the instructions for e-voting during the AGM as provided in the Notice of the AGM. Members

whose email addresses are not registered with the Company/Depository may follow the below process for registering or updating their email addresses.

Members holding shares in electronic/ Demat form, please update your email address with your

Phone : 079-26580767, Email : investor@rcspl.net Web : www.riddhicorp NOTICE OF THE 13[™] ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

NARMADA AGROBASE LIMITED
(L15494GJ2013PLC073468) Regd office: 613/P-1, IJ Pura (Jethaji) Dhanpura Road, Tal. Jotana, Mahesana Gujarat 384421 India Email: infonarmadaagrobase@gmail.com • website: www.narmadaagrobase.com NOTICE OF THE 11™ ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") OR OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

Notice is hereby given that the 11th Annual General Meeting of **NARMADA AGROBASE LIMITED** will be held on Saturday 30th September, 2023 at 11.30 A.M.
IST through video conferencing ("VC")/other Audio-Visual Means ("OAVM") Facility to transact the Ordinary Business, as set out in the Notice of the 11th AGM, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and Rules framed thereunder and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 20/2020 dated May 5, 2020 and subsequent Circulars issued from time to time and General Circular No 10/2022 dated December 28, 2022 read with relevant circulars issued by the Securities and Exchange Board of India (SEBI), from time to time (hereinafter collectively referred to as "Circulars)", has allowed the Companies to conduct the AGM through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) during the calendar year 2023. In Compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") and MCA Circulars, the 11th AGM of the Company is being held through VC/ OAVM.

In compliance with the aforesaid MCA Circulars and SEBI Circular, Notice of the AGM along with the Annual Report 2022-23 is being sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company Depositories. Members who requires physical copy of the Annual-Report, may request for the same. Members may note that the Notice and Annual Report 2022-23 will also be available on the Company's website **www.narmadaagrobae.com**, websites of the Stock Exchanges i.e BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com. The Procedure / Instruction for e-voting and joining AGM are provided in the notice of the AGM.

The remote e-voting period commences on Wednesday, September 27, 2023 (9.00 A.M. IST) and ends on Friday, September 29, 2023 (5.00 P.M. IST). During this period, Members of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of Friday, September 22, 2023, may cast their votes electronically. Members attending the AGM through VC/ OAVM, who have not cast their votes by remote e-voting shall be able to exercise their vote through e-voting during the AGM. The Members of the Company holding shares on the "cut-off date" of September 22, 2023 are entitled to vote on the resolutions proposed. The Members of the Company holding shares on the "cut-off date" of September 22, 2023 are entitled to vote on the resolutions proposed. Members wishing to claim dividends that remain unclaimed are requested to correspond with the RTA mentioned above or the Company Secretary of the Company or at cs@narmadaagrobase.com.

Members are requested to notify immediately any change of their address and bank particulars and updating their emails and mobile nos to Depository Participants and in case their shares are held in dematerialised form, and to the Company if shares are held in physical form without any delay to receive the notice of AGM or the login credentials for the E-voting by email.

In case of any members have any queries or issues regarding remote e-voting may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at https://www.evoting.nsdl.com under help section or write an email to evoting@nsdl.co.in or call at toll free no 1800-222-990 or contact the Company Secretary of the company at cs@narmadaagrobase.com

> By order of the Board For, Narmada Agrobase Limited Sd/-

Date: 08th September, 2023 Place: Ahmedahad

Company Secretary

પૂજાવેસ્ટ્રર્ન મેટાલિક્સ લિમિટેડ

सीनः L२७३२०GJ२०१۶PLC०६४३१४ રજુ. ઓફિસ: પ્લોટ નં. ૧, ફેઝ ૨, જુઆઇડીસી, ડારેડ, જામનગર, ગુજરાત-૩૬૧૦૦૪, (ભારત) દેલ. નં.: ૨૮૮-૨૭૩૦૦૮૮, વેબસાઇટ: www.poojametal.com ઇમેઇલ: poojametals@gmail.com

કંપનીની 7મી વાર્ષિક સામાન્ય સભા અને ઈ-વોર્ટિંગની સૂચના

આથી સુચના આપવામાં આવે છે કે કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને પરિપત્ર SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 દ્વારા જારી કરાયેલ 28 ડિસેમ્બર, 2022ના સામાન્ય પરિપત્ર નં. 10/2022ના અનુસંધાનમાં તારીખ 5 જાન્યુઆરી, 2023 ના રોજ સેબી દ્વારા જારી કરવામાં આવે છે (ત્યારબાદ સામૂહિક રીતે "ધ પરિપંત્ર" તરીકે ઓળખવામાં આવે છે), કંપનીઓને સામાન્ય સ્થળે સભ્યોની ભૌતિક હાજરી વિના, વીસી દ્વારા એજીએમ યોજવાની મંજૂરી આપવામાં આવે છે. આથી, પરિપત્રોના પાલનમાં, કંપનીની એજીએમ શનિવાર, 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ બપોરે 12:00 વાગ્યે વીસી દ્વારા યોજવામાં આવી છે. (IST). 7મી એજીએમની કાર્યવાહીનું સ્થળ કંપનીની નોંધાયેલ ઓફિસ એટલે કે પ્લોટ નં. 1, ફેઝ II, જીઆઈડીસી, દરેડ જામનગર-361004, ગુજરાતની નોટિસમાં દર્શાવ્યા મુજબ સામાન્ય વ્યવસાયો અને વિશેષ વ્યવસાયોના વ્યવહાર માટે રહેશે. 7મી એજીએમ. કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) દ્વારા જારી કરાયેલ 28 ડિસેમ્બર, 2022ના સામાન્ય

પરિપત્ર નં. 10/2022 અને તારીખ 5 જાન્યુઆરીના SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4ના પરિપત્ર અનુસાર, SEBI દ્વારા જારી કરાયેલ 2023 (ત્યારબાદ સામૂહિક રીતે "પરિપત્રો" તરીકે ઓળખવામાં આવે છે) વાર્ષિક અહેવાલ 2022-23 સાથે AGM ની સૂચના ફક્ત તે સભ્યોને જ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા મોકલવામાં આવી છે જેમના ઇમેઇલ સરનામાં કંપની/ડિપોઝિટરીઝમાં નોંધાયેલા છે. સભ્ય નોંધ લે કે નોટિસ અને વાર્ષિક અહેવાલ 2022-23 કંપનીની વેબસાઇટ www.poojametals.com પર, BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એટલે કે www.evoting.nsdl.com વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

એમસીએના પરિપત્રોના પ્રકાશમાં, શેરધારકો ડીમેટ સ્વરૂપે અથવા ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ધરાવે છે અને જેમણે તેમના ઇમેઇલ સરનામાં સબમિટ કર્યા નથી અને પરિજ્ઞામે જેમને 7મી એજીએમ અને વાર્ષિક અહેવાલ 2022-23ની નોટિસ આપી શકાઈ નથી, નીચે આપેલ પ્રક્રિયાને અનુસરીને તેઓ અસ્થાયી રૂપે સેવા આપી શકે છે. તેમના ઈ-મેલ સરનામાં રજીસ્ટર કરાવોઃ

- 1. જો શેર ભૌતિક સ્થિતિમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને ફોલિયો નંબર, શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્કેન કરેલી નકલ (આગળ અને પાછળ), PAN (પાન કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ), આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) info@poojametal.com પર ઇમેઇલ દ્વારા પ્રદાન કરો.
- 2. જો શેર ડીમેટ મોડમાં રાખવામાં આવ્યા હોય, તો કૃપા કરીને DPID-CLID (16 અંકનો DPID + CLID અથવા 16 અંકનો લાભાર્થી ID), નામ, ક્લાયન્ટ માસ્ટર અથવા કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની કોપિ, PAN (PAN કાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) આધાર (આધાર કાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) info@poojametal.com પર પ્રદાન કરો.
- વપરાશકર્તા ID અને પાસવર્ડ મેળવવા માટે વૈકલ્પિક રીતે સભ્ય ઇ-મેઇલ પર evoting@nsdl.co.in પર કેસ તરીકે પોઇન્ટ (1) અથવા (2) માં ઉલ્લેખિત વિગતોને સાબિત કરીને વિનંતી મોકલી શકે છે .

ઈ-મેલ એડ્રેસની સફળ નોંધણી પછી, શેરધારકને 7મી એજીએમ અને વાર્ષિક રિપોર્ટ 2022-23ની નોટિસની સોક્ટ કોપી અને 7મી માટે ઈ-વોટિંગ સક્ષમ કરવા માટે યુઝર-આઈડી અને પાસવર્ડ સાથે ઈ-વોટિંગ માટેની પ્રક્રિયા મળશે. એજીએમ. કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, શેરધારક કંપનીને info@poojametal.com પર પત્ર લખી શકે છે. શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના ડિપોઝિટરી સહભાગીઓ (ઓ) સાથે તેમના ઈમેલ આઈડીની નોંધશ્રી/અપડેટ કરે કે જેમની સાથે તેઓ તેમના ડીમેટ એકાઉન્ટ્સ જાળવી રાખે છે, જો જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને શેર ડીમટીરિયલાઈઝ્ડ મોડમાં રાખવામાં આવ્યા હોય.

શનિવાર, સપ્ટેમ્બર 23, 2023 ("કટ-ઓફ તારીખ") ના રોજ જે સભ્યોના નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભદાયી માલિકોના રજિસ્ટરમાં નોંધાયેલા છે, તેઓ ફક્ત દૂરસ્થ ઇ-ની સુવિધા મેળવવા માટે હકદાર હશે. વાર્ષિક સામાન્ય સભામાં મતદાન તેમજ ઈ-વોટિંગ.

કંપની અધિનિયમ, 2013 ની કલમ 108 ની જોગવાઈઓને અનુસરીને તે હેઠળ બનાવેલા નિયમો (સુધાર્યા પ્રમાજે) અને સેબી (LODR) રેગ્યુલેશન્સ, 2015 (સુધારેલા મુજબ) ના નિયમન 44 અને ઉપરોક્ત એમસીએ પરિપત્રો સાથે વાંચવામાં આવે છે. કંપની રિમોટની સુવિધા પૂરી પાડે છે. ઇ-વોટિંગ અને એજીએમની તારીખે ઇ-વોટિંગ તેના સભ્યોને એજીએમમાં વ્યવહાર કરવાના વ્યવસાયના સંદર્ભમાં. આ હેતુ માટે, કંપનીએ ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાનની સુવિધા માટે NSDL સાથે કરાર કર્યો છે.

રિમોટ ઈ-વોટિંગ બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. અને શુક્રવાર, સપ્ટેમ્બર 29, 2023 ના રોજ સાંજે 5:00 વાગ્યે સમાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન, કટ-ઓફ તારીખે શેર ધરાવનાર કંપનીના સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે તેમનો મત આપી શકે છે (રિમોટ ઈ-વોટિંગ). સભ્યો નોંધ લે કે a) NSDL દ્વારા મતદાન માટેની ઉપરોક્ત તારીખ અને સમય પછી રિમોટ ઈ-વોટિંગ મો.શુલને અક્ષમ કરવામાં આવશે અને એક વખત સભ્ય દ્વારા ઠરાવ પર મત આપવામાં આવે, પછી સભ્યને તેને બદલવાની મંજૂરી આપવામાં આવશે નહીં; b) ઈ-વોટિંગની સુવિધા 7મી એજીએમમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે; અને c) જે સભ્યોએ 7મી એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે તેઓ પણ 7મી એજીએમમાં હાજરી આપી શકે છે પરંતુ તેઓ ફરીથી તેમનો મત આપવા માટે હકદાર રહેશે નહીં. 7મી વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં રિમોટ ઈ-વોટિંગ/ ઈ-વોટિંગ માટેની

કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેર મેળવે છે અને એજીએમની નોટિસ મોકલ્યા પછી અને કટ-એફ તારીખ એટલે કે 23 સપ્ટેમ્બર, 2023ના રોજ શનિવારના રોજ શેર રાખ્યા પછી કંપનીના સભ્ય બને છે, તેમને એજીએમની નોટિસનો સંદર્ભ લેવા વિનંતી કરવામાં આવે છે. મત આપવા માટે USER ID અને પાસવર્ડ મેળવવા માટેની પ્રક્રિયા અપનાવવામાં આવશે. ઈ-વોટિંગ માટે કોઈપજ્ઞ પ્રશ્નોના કિસ્સામાં, તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ શેરધારકો

વિગતવાર પ્રક્રિયા પૂરી પાડવામાં આવી છે.

સ્થળઃ જામનગર

તારીખઃ ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૩

માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ટોલ ફ્રી નંબર : 1800-222-990 પર કોલ કરી શકો છો. અથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલો. સભ્યો કંપનીની નોંધાયેલ ઓફિસમાં કંપનીના કંપની સેક્રેટરી શ્રી તેજુસ રમેશચંદ્ર પીઠાડિયાનો પણ સંપર્ક કરી શકે છે અથવા કોઈપણ વધુ સ્પષ્ટતા માટે www.poojametals.com પર ઈ-મેલ લખી શકે છે.

સભ્યો VC/OAVM સુવિધા દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી શકે છે અને તેમાં ભાગ લઈ શકે છે. VC/OAVM દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચનાઓ વાર્ષિક સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો શેરધારકો/સભ્યોને એજીએમમાં ભાગ લેવા અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તમે evoting@nsdl.co.in પર ઈમેલ લખી શકો છો અથવા અમને કોલ કરોઃ ટેલિફોનઃ 1800-222-990. કંપની અધિનિયમ, 2013 ની ક્લમ 103 હેઠળ કોરમની ગણતરીના હેતુઓ માટે VC/OAVM દ્વારા મીટિંગમાં હાજર રહેલા સભ્યોની ગણતરી કરવામાં આવશે.

પૂજાવેસ્ટર્ન મેટાલિક લિમિટેડ વતી. એસડી/-સુનીલ દેવરામ પંચમતીયા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર

ડીનઃ 02080742

PALM JEWELS LIMITED

CIN:L36910GJ2005PLC046809
gistered Add: C/205, D/205, 2[™] Floor, Super Mall Besides Lal Bungalow, C.G. Road, Ahmedabad-380009, Gujarat, India
Phone: +91 8460449722 Email:compiliance.pjl@gmail.com Web: www.palmjewelsltd.com

NOTICE OF 18[™] ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 18th Annual General Meeting (AGM) of the Members of **Palm Jewel Limited** is scheduled to be held on **Saturday**, 30th **September**, **2023 at 11:00 AM** at the registere office of the Company at C/205, D/205, 02th Floor, Super Mall Besides Lal Bungalow, C.G. Road Office of the Coffinging at C/205, DIZVO, CZ Floor, Super Main Desides Lat Bungalow, C.G. Road, Ahmedabad - 380009, Gujarat, India to transact the business as set out in the Notice of the 18th AGM, which is being circulated for convening the AGM. The Company has already dispatched the Annual Report for the Financial Year 2022-23 along with the Notice convening 18th AGM through electronic mode to the Shareholders whose email address are registered with the Company and / or Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice of 18th AGM also available on the website of the company at www.palmjewelsltd.comand on the website of National Securities Depository Limited (NSCI). I at www.wextign.gad(c...) he website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdi.com.

As Per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Managemen and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2" issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share to the Company as on Friday, September 22, 2023 (the "cut-off date"). The details are required resolution to the proportion of the Companies and voting the Secretarian set 2013 and rules made the preparations of the Companies and voting the Secretarian set 2013 and rules made the preparations of the Companies and voting the Secretarian set 2013 and voting the Secretarian secretarian set 2013 and voting the Secretarian set 2013 and voting the Secretarian set 2013 and voting the Secretarian secretarian set 2013 and voting the Secretarian secretarian set 2013 and voting the Secretarian secret ursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below The Book closure period shall commence on 24th September, 2023 and ends on 30th September

- 2023 (both days inclusive); . The remote e-voting period will commence at 09:00 a.m. on Wednesday, September 27, 2023 and will end at 05:00 p.m. on Friday, September 29, 2023.
- Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, September 22, 2023;. The members will not be allowed to vote through remote e-voting beyond the period as specific above;
- . Shareholder acquiring the share of the company and becomes the members of the compar after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention the Notice of AGM to exercise their voting rights;
- . The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend participate in the AGM but shall not be entitled to cast their vote again.
- The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary to act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of voting to the Chairman.
- In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequent! Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholders available at www.evoting.nsdl.com.under.help.section.or.contact.at 022-23058542/43.

FOR, PALM JEWELS LIMITED Place : Ahmedabad Managing Director (DIN: 00543440) Date: 07/09/2023

SHISH INDUSTRIES LTD

શીશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

રજીસ્ટર્ડ ઓફિસ : ટીપી નંબર ૪, આરએસ નં. ૧૧ પૈકી, ૧૨–૧૩ બી પૈકી, પ્લોટ સી,

પહેલો માળ, ૧૧, ૧૨ સૂર્યપુર મિલ કમ્પાઉન્ડ, વરાછા રોડ, સુરત-૩૯૫ ૦૦૬. ગુજરાત, ભારત

કંપનીની સામાન્ય મીટિંગની સૂચના,

બુક બંધ, નક્કી કરેલી તારીખ અને ઇ-મતદાનની સૂચના આથી સૂચના આપવામાં આવે છે કે કોઈ એક સ્થળે સભ્યોની શારીરિક હાજરી વિના વિડિયો

સુંગઠન (VC) અથવા અન્ય ઓડિયો વિડિયો માધ્યમ (OAVM) દ્વારા સામાન્ય સભા યોજુવા માટે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય દ્વારા તારીખ ૮ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તારીખ ૧૩ મી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જારી

કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ અને તારીખ ૨૮ મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ

જારી કરાયેલા સામાન્ય પરિપત્ર નં. ૧૧/૨૦૨૨ પ્રમાણે શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કંપની) ના સભ્યોની સામાન્ય સભા (ઈજીએમ) શનિવારે તારીખ ૩0 મી સપ્ટેમ્બર, ૨0૨૩ એ સવારનાં

૧૧:૦૦ વાગ્યે ઈજીએમની સૂચનામાં જજ્ઞાવ્યા મુજબનાં ખાસ અને સામાન્ય વ્યવસાયો નો

ઉપર્ જજ્ઞાવેલા કોર્પોરેટ બાબતોનું મુંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે અને સેબી દ્વારા તારીખ ૧૩ મી મે, ૨૦૨૨ ના રોજ જારી કરાયેલ પરિપત્ર નં. સેબી/એચએ/સીએફડી/સીએમડીર/

સીઆઈઆર/પી/ ૨૦૨૨/૬૨, ઈજીએમની સચના ફક્ત તે જ સભ્યોને ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા મોકલવામાં આવી રહી છે, જેમના ઇમેઇલ સરનામાંઓ કંપની / ડિપોઝિટરીઝમાં

શુક્રવાર તારીખ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ નોંધાયેલા છે. સભ્યોને નોંધ લેવા વિનંતિ છે કે

ઈંજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.shishindustries.com પર, બીએસઈ

લિમિટેડની વેબસાઇટ www.bseindia.com પર અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી

ક્ષિમિટેડ (એનએસડીએલ) ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ મુકવામાં

ઉપર જજ્ઞાવેલા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નાં પરિપત્રો પ્રમાણે એ બધા સભ્યો કે જે ડીમેટ સ્વરૂપમાં અથવા ભૌતિક સ્વરૂપમાં કંપનીના ઇક્વિટી શેર ધરાવે છે અને પોતાનાં ઇ-મેઇલ

સરનામાં નૃથી નોંધાવ્યા જેના લીધે ઈજીએમની સૂચના નથી મોકલી શકાઇ એ સભ્યો

બસ્થાયીરૂપે તેમના ઇ-મેઇલ સરનામા કંપની સાથે આ પ્રમાજ્ઞે નોંધાવી શકે છે, (એ) જો

મૌતિક સ્વરૂપમાં શેર ધરાવો છો તો શેરધારકનું નામ, શેર પ્રમાણપત્રની સ્ક્રેન કરેલી નક્લ

(આગળ અને પાછળ), પાન (પાનકાર્ડની સ્વૅ-પ્રમાશ્ચિત સ્ક્રેન કરેલી નકલ), આધાર

(આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇ-મેઇલ કરી ને, (બી) જો ડીમેટ સ્વરૂપમાં ધરાવો છો તો નામ, DPID-CLID (16

અંકનો DPID + CLID અથવા 16 અંકોના લાભાર્થી ID), ક્લાયંટ માસ્ટર અથવા

કન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટની નકલ, પાન (પાનકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી નકલ),

આધાર (આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્કેન કરેલી નકલ) compliance@shishindustries.com પર ઇમેઇલ કરી ને, ૩) અથવા તો સભ્યો (આધારકાર્ડની સ્વ-પ્રમાશિત સ્ક્રેન કરેલી

પોઈન્ટ (એ) અથવા (બી) માં જણાવેલ વિગતો ઇ-મેઇલ દ્વારા evoting@nsdl.co.in પર

ઇ-મેઇલ સરનામાંની સફળ નોંધશી પછી, સભ્ય ને ઈજીએમ સંદર્ભે ઈજીએમની સૂચના ની

ઇલેક્ટ્રોનિક નકલો, યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેનો પ્રક્રિયા

મને ઇલેક્ટ્રોનિક મતદાન માટે સક્ષમ બનાવવા માટે મોકલવામાં આવશે. કોઈપણ પ્રશ્નો

કિસ્સામાં, સભ્યો compliance@shishindustries.com પર કંપનીને વિનંતી કરી શકે છે.

શેરધારકોને વિનંતી છે કે તેઓ તેમની સંપૂર્ણ બેંક વિગતો અને ઇમેઇલ આઈડી નોંધણી /

અપડેટ કરવા માટે તેમના ડિપોઝિટરી સહભાગીઓ, જેમની સાથે તેઓ ડિમટીરીયલાઇઝ્ડ

સ્વરૂપમાં હિસ્સો ધરાવે છે, તેને જરૂરી દસ્તાવેજો આપી ને તેમના ડિમેટ ખાતાની જાળવણી

કંપનીમાં કોઈપણ શેરહોલ્ડરો ભૌતિક સ્વરૂપમાં ઇક્વિટી શેર ન ધરાવતાં હોવાને કારણે,

કંપનીના સભ્યોના રજિસ્ટર અને શેર ટ્રાન્સફર પુસ્તકો બંધ રહેશે નહીં. એ બધા સભ્યો

જેમના નામ ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ (નક્કી કરેલી તારીખ) ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ

પાસેથી પ્રાપ્ત થયેલા લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક

મતદાન અને સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધાનો લાભ મેળવવાના

કંપનીઓનો ધારો, ૨૦૧૩ ("ધારો") ની કલમો ૧૦૮ ની જોગવાઈઓ અને અન્ય લાગુ જોગવાઈઓને અનુસરીને અને કંપનીઓ (સંચાલન અને વહીવટ) નિયમો, ૨૦૧૪ (સમય-

સમય પર સુધારેલા મુજબ) ("નિયમો) ના નિયમો ૨૦ ને સાથે વાંચીને અને સેબી (સ્ચિબદ્ધ

જવાબદારી અને જાહેરાત આવશ્યકતાઓ) નિયમનો, ૨૦૧૫ (સેબી સૂચિઓ નિયમો) ના

નિયમન ૪૪ અને અન્ય લાગુ કાયદા અને નિયમો ધ્યાનમાં રાખીને, કંપની તેના સભ્યોને

ઇજીએમમાં વ્યવસાયોને વ્યવહાર કરવા માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન અને સામાન્ય સભા

નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા પ્રદાન કરી રહી છે. કંપનીએ તમામ સભ્યોને

ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવા માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ

. સભ્યો નોંધી શકે છે કે દરસ્થ ઇલેક્ટોનિક મતદાન બધવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨0૨૩. નાં રોજ

સવારનાં ૦૯:૦૦ વાગ્યો થી શરૂ થશે અને શનિવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨0૨૩ નાં રોજ સાંજનાં

૦૫:૦૦ વાગતાં (બંને દિવસો સંહિત) પુર્જા થશે. આ સમયગાળા દરમિયાન, એ બધા સભ્યો

કે જેમના નામ નક્કી કરેલી તારીખ ના રોજ કંપનીના રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ દ્વારા

જાળવવામાં આવેલા સભ્યોના રજિસ્ટરમાં અને ડિપોઝિટરીઓ પાસેથી પ્રાપ્ત થયેલા

મોકલીને યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવા માટે વિનંતી કરી શકે છે.

યવહાર મંજૂર કરવા માટે VC / OAVM દ્વારા યોજવામાં આવશે.

આવ્યા છે.

હકદાર રહેશે.

"એનએસડીએલ") સાથે કરાર કર્યો છે.

ટેલિફોન : +૯૧ ૨૯૧ રેપપ ૦૫૭૯, વેબસાઇટ: www.shishindustries.com;

ย-มิย์ตะ compliance@shishindustries.com

GAUTAM GEMS LIMITED

CIN: L36911GJ2014PLC078802

Registered Add: 3^{soc} Floor, Office-301, Sumukh Super CompOund, Vasta Devadi Road, Surat- 395004, Gujarat.

Phone: 912612538046 Email: complianceggl@gmail.com Web: www.gautamgems.com NOTICE OF 10[™] ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 10th Annual General Meeting (AGM) of the Members of **Gautan Gems Limited** is scheduled to be held on **Saturday, 30th September, 2023 at 12:00 PM** througl /ideo Conference ("VC") / Other Audio Visual Means ("OAVM) to transact the business as set out the Notice of the 10" AGM, which is being circulated for convening the AGM. The Company har already dispatched the Annual Report for the Financial Year 2022-23 along with the Notice convening 10" AGM through electronic mode to the Shareholders whose email address are registered with the Company and / or Depositories in accordance with the Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India. The Annual Report along with the Notice of 10" AGM also available on the website of the company at www.gautamgems.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

As Per Section 108 of the CompaniesAct, 2013 read with Rule20 of the Companies (Manageme and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosur Requirements) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2" issued by the Institute of Company Secretary of India, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the AGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSDL. The voting rights of the members shall be in the proportion to the equity share held by them in the paid up equity share o the Company as on Friday, September 22, 2023 (the "cut-off date"), The details are required ursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below: The Book closure period shall commence on 24th September, 2023 and end on 30th September

- 2023 (both days inclusive); The remote e-voting period will commence at 09:00 a.m. on Wednesday, September 27, 2023
- and will end at 05:00 p.m. on Friday, September 29, 2023. Cut-off date for determining rights of entitlement of e-voting is Friday, September 22, 2023;
- The members will not be allowed to vote through remote e-voting beyond the period as specifie
- Shareholder acquiring the share of the company and becomes the members of the company after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention
- the Notice of AGM to exercise their voting rights; The Members who have cast their vote by remote e-voting prior to the AGM may also
- attend/narticipate in the AGM but shall not be entitled to cast their vote again. The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary to
- act as the Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of votin
- In case of any queries/grievances pertaining to remote e-voting you may refer to the Frequently Asked Questions (FAQs') for Shareholders and e-voting user manual for Shareholders available at www.evoting.nsdl.com under help section or contact at 022-23058542/43.

 FOR, GAUTAM GEMS LIMITED

sd/- GAUTAM P SHETH Place : Surat Managing Director (DIN: 06748854) Date: 07/09/2023

Depository Participants. However, Members may temporarily register the same with the Company's Registrar & Share Transfer Agent i.e. M/S PURVA SHAREGISTRY (INDIA) PVT. LTD at https://www.purvashare.com/email-and-phone-updation/on their website www.purvashare.com/ in the Register your Email id tab by providing details such as Name, DPID, Client ID, PAN, mobile number and e-mail address. In case of any queries pertaining to e-voting members may refer to the Frequently Asked Questions ("FAQs") and the e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com

Place : Ahmedabad Date: 6th September, 2023

यूनियन बैंक 🕠 Union Bank

भिલકत नं. ४

તારીખ : ૦૯.૦૯.૨૦૨૩

સ્થળ : આણંદ

રીજનલ ઓક્સિ - આણંદ. દુકાન નં. ૨૨૨-૨૨७, બીજો માળ, . મારૂતિ સોલારીસ, મધુબન રીસોર્ટ પાસે, આણંદ - સોજીત્રા રોડ, આણંદ - ૩૮૮૦૦૧.

વેચાણ નોટીસ સ્થાવર મિલકતો માટે વેચાણ

e-voting system during the AGM.

Registration of e-mail addresses:

६ - हराळिची मोडीस : બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલા

FOR, RIDDHI CORPORATE SERVIES LIMITED sd/- MUSTAFA MUFADDALBHAI SIBATRA

Compliance Officer & Company Secretary

સિક્યોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ - ૨૦૦૨ નો નિયમ ૮(૬) ના પ્રોવિઝોની સાથે સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી **ઇન્ટરેસ્ટ એક્ટ-૨૦૦૨ અન્વચે સ્થાવર મિલકતોનું ઇ - હરાજી વેચાણ માટે વેચાણ નોટીસ**. આથી જાહેર જનતાને તથા ઉધારકર્તાઓ અને જામીનદારોને વિશેષ રૂપથી નોટીસ આપવામાં આવે છે કે સિક્યોર્ડ ક્રેડીટરને ગીરો મુકેલ નીચે દર્શાવેલ સ્થાવર મિલકર્તોનો **ચુનિચન બેંક ઓફ ઇન્ડિચા** ના અધિકૃત અધિકારી દ્રારા કબજો લેવાયેલ છે, નીચે દર્શાવેલ ઉધારકર્તાઓ અને જામીનદારો પાસેથી નીચે દર્શાવેલ બાકી લેશાંના વસુલાત હેતુ આવી મિલકતોનું **"જ્યાં છે, જેમ છે અને જે કંઇ પણ છે**" ના ધોરણે નીચે દર્શાવેલ તારીખે વેચાણ કરવામાં આવશે. અનામત કિંમત સાથે ઈએમડી ની રકમ પણ નીચે જણાવેલ છે.

ω, σ	
શાખાનું નામ અને સરનામું	આણંદ શાખા : કાશી ધામ, મહર્ષિ દયાનંદ માર્ગ, આણંદ, જીલ્લો - ૩૮૮૦૦૧, શાખા મેનેજર : શ્રી પ્રમોદકુમાર ચાદવ (મો) : ૯૦૭૫૪૪૯૧૭૬
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી ઇરેનિયસ પોલ પો (ઉધારકર્તા) અને શ્રીમતી પો કલ્પના ઇરેનિયસ (સહ-ઉધારકર્તા)
બાકી લ્હેણી રકમ	રૂા. ७,०७,०७२.५२, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિાન)
ਮਿલકત નં. ૧	તમામ ભાગ અને હિસ્સા સાથે દુકાન નં.૨૧૬, ક્રિષ્ના કોમ્પલેક્ષ, બેઝમેન્ટ માળ, આર.એસ.નં.૧૩૨૭/એ પૈકી સીટીએસ નં. ૨૧૯૨/બી/૧, મ્યુનીસીપલ નં.૧૨/૨/૧૩૭/૭, બોરસદ ચોકી, આણંદ, તાલુકો અને જીલ્લો આણંદ. ક્ષેત્રફળ : ૧૪.૮૬ સ્કે.મીટર. ચતુઃસીમા :- ઉત્તરે : દુકાન નં.૨૧૫, દક્ષિણે : દુકાન નં.૨૧૭, પૂર્વે : આણંદ-બોરસદ રોડ પછી માર્જીનની જગ્યા, પશ્ચિમે : દુકાન. (સાંકેતિક કબજો)
હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત ઃ રૂા. ૫,૮૦,૦૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૫૮,૦૦૦/-	
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી કાનન વેઇંગ સિસ્ટમ્સ, પ્રો.શ્રી ભરતભાઇ જશભાઇ પટેલ (ઉદારકર્તા) અને શ્રી કમલેશભાઇ મોતીભાઇ પારેખ (સહ-બંધનકર્તા / જામીનદાર) અને શ્રીમતી રેખાબેન ભરતભાઇ પટેલ (સહ-બંધનકર્તા/જામીનદાર)
બાકી લ્હેણી રકમ	રૂા. ૨૮,૬૬,૬૦૫.૨૦, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)

Galescii/ Meloicieig oliei	જામીનદાર) અને શ્રીમતી રેખાબેન ભરતભાઈ પટેલ (સહ-બંધનકર્તા/જામીનદાર)
બાકી લ્હેણી રકમ	રૂા. ૨૮,૬૬,૬૦૫.૨૦, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
મિલકત નં. ૨	તમામ ભાગ અને હિસ્સા સાથેનો સબ પ્લોટ નં.૭, સૂર્યાદિપ ટેનામેન્ટ, આર.એસ. નં. પ૩૯/૧, + ૪, એફપી નં.૨૧, ટીપીએસ ૭ સતાવીસ ગામ સ્કુલ પાસે, ૮૦ ફીટ રોડ, આણંદ -૩૮૮૦૦૧, ક્ષેત્રફળઃ ૧૨૨.૫૦ સ્કે.મીટર, ચતુઃસીમા ઃ- ઉત્તરે : રોડ, દક્ષિણે ઃ ટીપીએસ નં.૭ નો પ્લોટ નં. ૨૪,૨૫,૨૬, પૂર્વે ઃ સૂર્યાદીપન નો એસ. પ્લોટ નં.૬, પશ્ચિમે : સૂર્યાદીપન નો એસ. પ્લોટ નં.૮. (સાંકેતિક કબજો)
હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૩૦,૮૫,૫૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૩,૦૮,૫૫૦/-
શાખાનું નામ અને સરનામું	નડીયાદ શાખા : કર્મવીર ટાવર, ક્પડવંજ રોડ, નડીયાદ, ગુજરાત, શાખા મેનેજર : શ્રી સતેન્દ્ર આર્ચ (મો) : ૮૩૪૮૮७७७०४
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી વિનુભાઈ નાગજીભાઈ ભરવાડ અને શ્રી બાલાભાઈ નાગજીભાઈ ભરવાડ

બાકી લ્હણી રકમ	રૂા. ૧૫,૯૪,૯૪૩.૮૬, તા.૩૦.૦૯.૨૦૧७ + ચક્ત વ્યાજ, કાસ્ટ અને અન્ય ખચાઆ (ત્યાર પછા આવલ વસુલાતને આદિન)	
भिલક्त नं. ३	તમામ ભાગ અને હિસ્સા સાથેનો પ્લોટ નં. એક /૧૧૧, કર્મવીર સુંદરવન-૩, કર્મવીર સુંદરવાટિકા-૧ પાસે, પ્રભુકુટિર સામે, મંજીપુરા રોડ, નડિયાદ, ગુજરાત પ્લોટ એરીયા - ૬૦૬ સ્કે.કીટ ચતુઃસીમા :- ઉત્તરે : પ્લોટ નં. એક/૧૧૨, દક્ષિણે : પ્લોટ નં. એક/૧૧૦, પૂર્વે : પ્લોટ નં. એક/૧૧૮, પશ્ચિમે : સોસાયટી રોડ. (પ્રત્યક્ષ કબજો)	
હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત ઃ રૂા. ૧૧,૫૯,૨૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૧,૧૫,૯૨૦/-		
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી ચિરાગ રાધવેન્દ્ર તિવારી અને શ્રી કાર્તિક રાધવેન્દ્ર તિવારી	
બાકી લ્હેણી રકમ	રૂા. ૩૦,૦૨,૧૫૮, તા.૩૧.૦૧.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)	
	न्याय त्यांश करे हिस्सा आशेनो हार नं १९२ दर्धतीर संदर्भाश ना निरंगार शब्दान केरीया ला करे भीरू अनःसीमा ः हिन्दे कोश नं १९१	

ı	હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૬,૩૧,૧૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૩,૧૧૫/-
1		
	ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	કું. વિનીતાબેન જચક્રિષના ગાંધી અને શ્રી આશુતોષ ભાનુપ્રસાદ રાણા
	બાકી લ્હેણી રકમ	રૂા. ૨૫,૫૬,७૬૦/-, તા.૩૧.૧૦.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન)
		તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. બી-૨૧. કર્મવીરસંદરબાગ, રાધાસ્વામી સત્સંગ ભવન પાસે. પીજ રોડ. ગામ: ટંડેલ, નડિયાદ, ગજરાત એરીયા ૮૦૭ સ્કે.કીટ.

દક્ષિણે ઃ સુંદરબાગ કંમ્પાઉન્ડવોલ પછીની બાઉન્ડ્રી, પૂર્વે ઃ એચ.નં.૯૭, પશ્ચિમે ઃ સોસાયટી એપ્રોચ રોડ. (પ્રત્યક્ષ કબજો)

, ,	9
બાકી લ્હેણી રકમ	રૂા. ૨૫,૫૬,७૬૦/-, તા.૩૧.૧૦.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન)
G	તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. બી-૨૧, કર્મવીરસુંદરબાગ, રાધાસ્વામી સત્સંગ ભવન પાસે, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૮૦૭ સ્કે.ફીટ. ચતુઃસીમા :- ઉત્તરે : સોસાયટી એપ્રોચ રોડ, દક્ષિણે : ઘર નં, બી-૨૦, પૂર્વે : જમીનનો એસ.નં.૧૩૬/૨, પશ્ચિમે : ઘર નં, બી-૨૨. (પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૬,૫૧,૫૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૫,૧૫૫/-	

બાકી લ્હેશી સ્કમ રૂ. ૨૬,૯૨,૯૨૫/-, તા.૨७.૦૨.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિન) તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૮૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૭૫.૦૦ સ્કે.મી. ચતુઃસીમા :- ઉત્ત	ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી પ્રતિકકુમાર રાજેન્દ્રકુમાર પટેલ અને ધારાબેન પ્રતિકકુમાર પટેલ
તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૮૨, કર્મવીરસુંદરભાગ, પીજ રોડ, ગામઃ ટડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૭૫.૦૦ સ્કે.મી. ચતુઃસીમા ઃ- ઉ ત્ત	બાકી લ્હેણી રકમ	રૂા. ૨૬,૯૨,૯૨૫/-, તા.૨७.૦૨.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
મિલકત <i>ર્ગ. ક</i> ઘર નં. ૮૩, દક્ષિણે ઃ ઘર નં, ૮૧, પૂર્વે ઃ સોસાયટી એપ્રોચ રોડ, પશ્ચિમે ઃ ઘર નં, ૯૫. (પ્રત્યક્ષ કબજો)		તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૮૨, કર્મવીરસુંદરભાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૭૫.૦૦ સ્કે.મી. ચતુઃસીમા ઃ- ઉત્તરે ઃ ઘર નં. ૮૩, દક્ષિણે ઃ ઘર નં, ૮૧, પૂર્વે ઃ સોસાયટી એપ્રોચ રોડ, પશ્ચિમે ઃ ઘર નં, ૯૫. (પ્રત્યક્ષ કબજો)

erigon circion oldi tidia .	co. eccess on the data acres at the grown state of the co. ecc.
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી વિપુલ બાલકિષ્ના ભરૂ અને શ્રીમતી જાગૃતિ વિપુલ ભરૂ
બાકી લ્હેણી રકમ	રૂા. ૨૫,૯૯,૨૩७.૮૦, તા.૩૧.૦७.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
l Green in	તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૧૭૨, કર્મવીરસુંદરબાગ, પીજ રોડ, ગામઃ ટંડેલ, નડિયાદ, ગુજરાત એરીયા ૮૦૭ સ્કે.ફીટ. ચતુઃસીમા ઃ- ઉત્તરે ઃ ઘર નં. ૧૭૧ દક્ષિણ ે : ઘર નં. ૧૭૩. ૫૦ઁ : ઘર નં. ૧૯૫. ૫૭મ્મે : સોસાયટી રોડ.(પ્રત્યક્ષ ક્બજો)

ामलङ्गत न. ७	ઘર નં. ૧૭૧ દક્ષિણ ઃ ઘર નં, ૧૭૩, પૂર્વે ઃ ઘર નં, ૧૬૫, પશ્ચિમે ઃ સોસાયટી રોડ.(પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૬,૩૧,૧૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૬૩,૧૧૫/-

ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ શ્રી યોગેશભાઈ રમેશભાઈ પંડચા અને શ્રીમતી ખુશ્બુ આર. પંડચા રૂા. ૧૬,૦૨,૩૬૫/-, તા.૩૧.૦૯.૨૦૧૯ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન) બાકી લ્હેણી રકમ ામામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં.એ/૧૬ પર ઘર. કર્મવીરનગર -Ⅷ, નયા-બીલોદરા, ગામ-બીલોદરા, નડિયાદ, ગુજરાત. પ્લોટ એરિયા ૯૨૧ भिલકत नं. ८ સ્કે.ફીટ્સ, **ચતુઃસીમા**ઃ- **ઉત્તરે**ઃ કેનાલ, **દક્ષિણે**ઃ પ્લોટ નં.એ/૧૫, **પૂર્વે**ઃ એપ્રોચ રોડ, પશ્ચિ**મે**ઃ સર્વે નં. ૧૧૧ પૈકી ખેતીલાયક જમીન.(પ્રત્યક્ષ કબજો)

હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા. ૧૦,૫૮,૨૫૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૦૫,૮૨૫/-

	ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી કમલેશભાઈ રમેશભાઈ ચોહાણ અને શ્રીમતી સ્મીતાબેન કમલેશભાઈ ચોહાણ
l	બાકી લ્હેણી રકમ	રૂા. ૨૧,૫૨,૫૯૦.૫૨, તા.૩૧.૦૧.૨૦૧७ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિાન)
	Grand at 1 a	તમામ ભાગ અને હિસ્સા સાથે ઘર નં. ૨૩, કર્મવીરસુંદરબાગ, ટંડેલ, તા. નિડયાદ, ગુજરાત એરીયા ૬૦ સ્કે.મીટર, ચતુઃસીમા ઃ- ઉત્તરે ઃ એચ. નં.૨૨, દક્ષિણે ઃ એચ. નં.૨૪, , પૂર્વે ઃ સોસાયટી એપ્રોચ રોડ, પશ્ચિમે ઃ એચ. નં.૧૮, .(પ્રત્યક્ષ કબજો)
П	हराञ्चनी तारीफ अने समय :	. ૨૬.૦૬.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે 🌑 અનામત કિંમત : ૩ા. ૧૮.૨૩.૫૦૦/- 🕲 અર્નેસ્ટ મની ડીપોઝીટ : ૩ા. ૧.૮૨.૩૫૦/-

શાખાનું નામ અને સરનામું	ઉત્તરસંડા શાખા : મધુકુંજ બિલ્ડીંગ, શ્રીજી આઈસ્ક્રીમની પાસે, મેઇન રોડ, તાલુકો - નડીચાદ, ઉત્તરસંડા, જીલ્લો - ખેડા, ગુજરાત - ૩૮७૩७૦, શાખા મેનેજર : શ્રી ઉપેન્દ્રકુમાર, (મો) : ૯७૯૨૦૦૪૦७૪
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રી અનિલકુમાર નરોત્તમદાસ ઠક્કર (ઉદ્યારકર્તા), શ્રીમતી ગીતાબેન અનિલકુમાર ઠક્કર (સહ - ઉદ્યારકર્તા),
બાકી લ્હેણી રકમ	રૂા. ૧७,૩૪,૮૩૯.૨७, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
મિલકત નં. ૧૦	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર ઈ-૨૧, કર્મવીર સુંદરવન -III, કર્મવીર વાટીકા -૧ પાસે, મંજીપુરા, તા. નડિયાદ, જીલ્લો - ખેડા. એરીયા ૭૫ સ્કે.મીટર. ચતુઃસીમા :- ઉત્તરે : પ્લોટ નં. ઈ/૨૨, દક્ષિણે : પ્લોટ નં. ઈ/૨૦, પૂર્વે : એપ્રોચ રોડ, પ શ્ચિમે : ઘર નં. ડી/૮૦. (પ્રત્યક્ષ કબજો)
हराळची चारीम अन्ते अपन् .	उद्दर्भ कर २०२२ मा शेल तमोडे २२ ०० थी आंले म ०० हताई ८ अम्बायन हिंग्स र २। १० २० ४००/- ८ अम्बेटर यनी दीमोसीट र २। १ ०० २००/-

ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રીમતી ભાવનાબેન પ્રદિપકુમાર કેોરાની (ઉદ્યારકતી), શ્રી પ્રદિપકુમાર પીતાંમ્બરદાસ કેોરાની (સહ - ઉદ્યારકર્તા),
બાકી લ્હેણી રકમ	રૂા. ૧૫,૯૫,૬૩૯.૨૨, તા. ૩૧.૦૩.૨૦૨૧ + ચડત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આધિન)
મિલકત નં. ૧૧	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર એક-૧૨૧, કર્મવીર સુંદરવન - III, કર્મવીર વાટીકા -૧ પાસે, મંજીપુરા, તા. નિડયાદ, જીલ્લો - ખેડા. એરીયા ૪૪ સ્કે.મીટર. ચતુઃસીમા :- ઉત્તરે : પ્લોટ નં. એક/૧૨૦, દક્ષિષ્ટો : પ્લોટ નં.એક/૧૨૨, પૂર્વે : ૬ મીટર એપ્રોચ રોડ, પશ્ચિમે : પ્લોટ નં.એક/૧૦૮. (પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે • અનામત કિંમત : રૂા.૧૦,૯૬,૫૦૦/- • અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૦૯,૬૫૦/

હરાજીની તારીખ અને સમય :	૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ કલાકે ● અનામત કિંમત : રૂા.૧૦,૯૬,૫૦૦/- ● અર્નેસ્ટ મની ડીપોઝીટ : રૂા. ૧,૦૯,૬૫૦/-
ઉદ્યારકર્તા/જામીનદારોનું નામ	શ્રીમતી ગાયત્રી હર્ષદકુમાર પંચાલ અને શ્રીમતી પ્રિયંકા હર્ષદકુમાર પંચાલ
બાકી લ્હેણી રકમ	રૂા. ૧૦,૦૩,૫૫૪.૫૫, તા. ૩૧.૦૮.૨૦૧૯ + ચક્ત વ્યાજ, કોસ્ટ અને અન્ય ખર્ચાઓ (ત્યાર પછી આવેલ વસુલાતને આદિાન)
મિલકત નં. ૧૨	તમામ ભાગ અને હિસ્સા સાથેનો ઘર એ/૧૩૬, કર્મવીર સુંદરવન, મંજીપુરા રોડ, નડિયાદ. બિલ્ટઅપ એરીયા ૧૨૪ સ્કે. મીટર. ચતુઃસીમા :- ઉત્તરે : પ્લોટ નં. એ/૧૩૫, દક્ષિણે : પ્લોટ નં.એ/૧૩૭, પૂર્વે : એપ્રોચ રોડ, પ શ્ચિમે : પ્લોટ નં.એ/૧૩૩. (પ્રત્યક્ષ કબજો)
હરાજીની તારીખ અને સમય ઃ ૨૬.૦૯.૨૦૨૩ ના રોજ બપોરે ૧૨.૦૦ થી સાંજે ૫.૦૦ ક્લાકે ● અનામત કિંમત ઃ રૂા.૨૩,૨૪,७૫૦/- ● અનેંસ્ટ મની ડીપોઝીટ ઃ રૂા. ૨,૩૨,૪७૫	

કરાજી વેચાણના વિગતવાર નિયમો અને શરતો માટે બિકર્સને વેબસાઈટ : https://www.ibapi.in, and www.unionbankofindia.co.in ટેન્ડર પર જવાની સલાહ આપવામાં આવે છે નોંધણી અને લોગીન અને બિડીંગ નિયમો માટે મુલાકાત લો : https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp

(અસલ અંગ્રેજી પરથી અનુવાદ)

અધિકૃત અધિકારી,

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા

સતીશકુમાર માણીયા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિયામક ઓળખ નંબર: ૦૨૫૨૯૧૯૧ સ્થળઃ સુરત તારીખઃ ૦૮/૦૯/૨૦૨૩

લાભદાયી માલિકો દેખાય છે ફક્ત એ જ સભ્યો દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાનની સુવિધાનો લાભ મેળવવાના હકદાર રહેશે અને આવા સભ્યો ઇલેક્ટ્રોનિક રીતે પોતાનો મત આપી શુકશે. ત્યારબાદ એનએસડીએલ દ્વારા દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન કરવા માટે ઇ-મતદાન મો.ક્યુલ અક્ષમ કરવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર મત આપ્યા પછી, તે / તેશ્રીને પછીથી બદલવાની અથવા ફરીથી મત આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સામાન્ય સભા નાં દિવસે ઇલેક્ટ્રોનિક મતદાન ની સુવિધા આપવામાં આવશે. જે સભ્યોએ ઇજીએમ પહેલાં દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન દ્વારા પોતાનો મત આપ્યો છે તે પણ ઇજીએમ માં હાજર રહી શકે છે પરંતુ તેઓ ફરીથી મતદાન કરવાનો હકદાર રહેશે નહી. દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન / ઇલેક્ટ્રોનિક મતદાન માટેની વિગતવાર પ્રક્રિયા ઇજીએમ ની સૂર્ચનામાં આપવામાં આવેલી છે. કોઈપણ વ્યક્તિ, જે કંપનીના શેરો ઇજીએમની સૂચના મોકલ્યા પછી મેળવે છે અને નક્કી કરેલી તારીખ પર ધરાવે છે, તે evoting@nsdl.co.in અથવા compliance@shishindustries.com પર વિનંતી મોકલીને યુઝર આઇડી અને પાસવર્ડ અને ઇલેક્ટ્રોનિક મતદાન માટેની પ્રક્રિયા મેળવી શકશે. જો કે, જો તમે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક

મતદાન માટે પહેલેથી જ એનએસડીએલ સાથે નોંધાયેલ છે, તો પછી તમે તમારા મત આપવા માટે તમારી હાલની યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો તમે www.evoting.nsdl.com પર ઉપલબ્ધ "પાસવર્ડ ભૂલી ગયા છો" વિકલ્પનો ઉપયોગ કરીને તમારો પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો.

દુરસ્થ ઇલેક્ટ્રોનિક માધ્યમને લગતાં કોઈપજ્ઞ પ્રશ્નોના કિસ્સામાં, તમે સભ્યો દ્વારા વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) નો સંદર્ભ લો અને www.evoting.nsdl.com ના ડાઉનલોડ વિભાગ પર ઉપલબ્ધ સભ્યો માટે દૂરસ્થ ઇલેક્ટ્રોનિક મતદાન વપરાશકર્તા માર્ગદર્શિકા અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફ્રોન કરી શકો છો બથવા evoting@nsdl.co.in પર વિનંતી મોકલી શકો છો. સભ્યો કંપનીની રજિસ્ટર્ડ બોફિસ પર શ્રીમતી વિભા ખંડેલવાલ, કંપની સચિવ અને પાલન અધિકારી, નો સંપર્ક પણ ર્સી શકે છે અથવા compliance@shishindustries.com પર ઇ-મેઇલ લખી શકે છે અથવા વધુ સ્પષ્ટતા માટે +૯૧ ૨૬૧ ૨૫૫ ૦૫૮૭ ફોન કરી શકે છે.

સભ્યો ફક્ત VC / OAVM સવિધા દ્વારા સામાન્ય સભામાં ભાગ લઈ શકે છે. સામાન્ય સભામાં જોડાવા માટેની સૂચના સામાન્ય સભાની સૂચનામાં આપવામાં આવી છે. જો સભ્યો ને ઇજીએમમાં ભાગ ર્લેવા સંબંધિત કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ છે, તો તમે :voting@nsdl.co.in પર ઇમેઇલ લખી શકો છો અથવા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨ ૪૪ ૩૦ પર ફ્ષેન કરી શકો છો. VC / OAVM દ્વારા ઇજીએમમાં ભાગ લેનારા સભ્યોની ગજ્ઞતરી કંપનીઓનો ધારો, ૨૦૧૩ ની ક્લમ ૧૦૩ હેઠળ કોરમની બોર્ડના આદેશ દ્વારા શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગજ્ઞતરીના હેતુ માટે કરવામાં આવશે.